



# MAHALAXMI RUBTECH LIMITED

OFFSET PRINTING BLANKETS | TECHNICAL COATED FABRICS

Ref: MRT/CS/Correspondence/2021-22/41

Date: October 11, 2021

To,  
**BSE Limited**

Phiroze Jeejeebhoy Tower,  
Dalal Street, Fort,  
Mumbai - 400 001.

**Company/Scrp Code: 514450**

Dear Sir,

**Sub : Publication of notice regarding reminder to physical shareholders for Buyback.**

Please find attached herewith Notice of reminder to physical shareholders for Buyback of Shares of the Company Mahalaxmi Rubtech Limited published in dated October 10, 2021 published in Financial Express (English), Jansatta (Hindi) and Financial Express (Gujarati) on October 11, 2021. The newspaper cuttings are enclosed herewith for your record.

Please take the same on record and oblige.

Thanking you,

Yours faithfully,

**For, Mahalaxmi Rubtech Limited**

**Kevin Dhruve**  
**Company Secretary**  
**ICSI Membership No.: A60857**



Encl.: a/a

**JM FINANCIAL MUTUAL FUND NOTICE**



**Uploading half yearly portfolio for the period ended September 30, 2021 for the schemes of JM Financial Mutual Fund:**

Notice is hereby given that in accordance with Regulation 59A of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 read with SEBI circular no. SEBI/HO/IMD/DF2/CIR/P/2018/92 dated June 05, 2018, the statement of portfolio of the schemes of JM Financial Mutual Fund ("the Fund") for the half year ended September 30, 2021 has been hosted on the website of the Fund viz [www.jmfinancialmf.com](http://www.jmfinancialmf.com) and on the website of AMFI viz [www.amfiindia.com](http://www.amfiindia.com).

The Portfolio/s of the respective scheme/s has/have been sent to all the investors whose email ids are registered with us. However, while the investors can refer to any of the above sites for the scheme's portfolio pertaining to their respective investments, they can also request for a physical/ soft copy thereof through any of the following means:

- Telephone: Call our toll free number at 1800 1038 345
- E-Mail: Send an email to [investor@jmf.com](mailto:investor@jmf.com)
- Letter: Submit a letter at any of the Investor Service Centres of the Fund or Registrar M/s. KFin Technologies Pvt Ltd., details of which are available at [www.jmfinancialmf.com](http://www.jmfinancialmf.com).

Unit holders are requested to take note of the aforesaid.

Place : Mumbai Authorised Signatory  
JM Financial Asset Management Limited  
(Investment Manager to JM Financial Mutual Fund)  
Date : October 9, 2021

**For further details, please contact :**  
JM Financial Asset Management Limited  
(Formerly known as JM Financial Asset Management Private Ltd.),

**Registered Office:** 7th Floor, Energy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400025.  
**Corporate Office:** Office B, 8th Floor, Energy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai-400025.  
Corporate Identity Number: U65991MH1994PLC078879. • Tel. No.: (022) 6198 7777  
• Fax No.: (022) 6198 7704. • E-mail: [investor@jmf.com](mailto:investor@jmf.com) • Website : [www.jmfinancialmf.com](http://www.jmfinancialmf.com)

**Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.** REF No. 18/2021-22

**IDFC**  
IDFC MUTUAL FUND

**NOTICE**

**Half-Yearly Portfolio Statement of schemes of IDFC Mutual Fund:**

NOTICE is hereby given that pursuant to Regulation 59A of SEBI (Mutual Funds) Regulations, 1996 and SEBI Circular dated June 05, 2018 on Go Green Initiative, half-yearly portfolio statement of schemes of IDFC Mutual Fund for period ended September 30, 2021 has been hosted on the website of IDFC Mutual Fund - <https://www.idfcmf.com> and on the website of Association of Mutual Funds in India (AMFI) - [www.amfiindia.com](http://www.amfiindia.com). Investors can view or download the same from the website of the IDFC Mutual Fund.

Investors can also request for the physical/soft copy of portfolio statement of schemes through any of the following modes:

- Send an email to [investor@idfc.com](mailto:investor@idfc.com).
- Submit a letter at any of the AMC Offices or our CAMS Investor Service Centres, details of which are available on the [www.idfcmf.com](http://www.idfcmf.com).
- Contact us at our toll free number 1-800-2666688/1-800-3006688

Place : Mumbai  
Date : October 09, 2021

**Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.**

**PPFAS**  
MUTUAL FUND  
There's only one right way!

**Disclosure / Hosting of Half Yearly Portfolio of the Schemes of PPFAS Mutual Fund**

All unit holders of PPFAS Mutual Fund are requested to note that in terms of Regulation 59A of SEBI (Mutual Funds) Regulations, 1996 and SEBI circulars issued in this regard from time to time, the Half Yearly Portfolio for the period ended September 30, 2021 of Schemes of PPFAS Mutual Fund have been hosted on the website of PPFAS Mutual Fund viz; [www.amc.ppfas.com](http://www.amc.ppfas.com) and on the website of Association of Mutual Funds in India, [www.amfiindia.com](http://www.amfiindia.com). Investors can access / download the half yearly disclosure from the above-mentioned websites.

Investors are requested to take note of the same.

Further, investors can submit a request for a physical or electronic copy of half yearly portfolio for the period ended September 30, 2021 by any of the following modes at free of cost:

- Email to us at [mf@ppfas.com](mailto:mf@ppfas.com) or
- Contact us at Investor Helpline no. 1800-266-7790 or
- Sending a written request at the Registered office address of the PPFAS Asset Management Private Limited as given below.

**For PPFAS Asset Management Private Limited**  
(Investment Manager to PPFAS Mutual Fund)  
Sd/-  
Director

Place: Mumbai  
Date: 09th October, 2021

**Name of Mutual Fund: PPFAS Mutual Fund**

For more information please contact:  
**PPFAS Asset Management Private Limited (Investment Manager for PPFAS Mutual Fund)**  
CIN No. : - U65100MH2011PTC220623  
**Registered Office:** - 81/82, 8th Floor, Sakhar Bhavan, Ramnath Goenka Marg, 230 Nariman Point, Mumbai - 400 021, INDIA. Tel.: 91 22 6140 6555 Fax: 91 22 6140 6590.  
E-mail: [mf@ppfas.com](mailto:mf@ppfas.com). Website: [www.amc.ppfas.com](http://www.amc.ppfas.com). Toll Free Number: 1800-266-7790.

**MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.**

**ICICI Prudential Asset Management Company Limited**  
Corporate Identity Number: U99999DL1993PLC054135

**Registered Office:** 12<sup>th</sup> Floor, Narain Manzil, 23, Barakhamba Road, New Delhi - 110 001.  
**Corporate Office:** One BKC, 13<sup>th</sup> Floor, Bandra Kurla Complex, Mumbai - 400 051.  
Tel.: +91 22 2652 5000, Fax: +91 22 2652 8100, Website: [www.icicipruamc.com](http://www.icicipruamc.com),  
Email id: [enquiry@icicipruamc.com](mailto:enquiry@icicipruamc.com)  
**Central Service Office:** 2<sup>nd</sup> Floor, Block B-2, Nirlon Knowledge Park, Western Express Highway, Goregaon (E), Mumbai - 400 063. Tel.: 022 2685 2000 Fax: 022 26868313

**Notice to the Investors/Unit holders of ICICI Prudential Mutual Fund**  
**Half-Yearly Portfolio Statement of Schemes**

**NOTICE is hereby given that the half-yearly portfolio statement of schemes of ICICI Prudential Mutual Fund for half year ended September 30, 2021 shall be hosted on October 10, 2021 on the website of ICICI Prudential Asset Management Company Limited (the AMC) viz. [www.amfiindia.com](http://www.amfiindia.com) and on the website of Association of Mutual Funds in India (AMFI) viz. [www.amfiindia.com](http://www.amfiindia.com) in accordance with Regulation 59A of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996, read with SEBI Circular No. SEBI/HO/IMD/DF2/CIR/P/2018/92 dated June 5, 2018.**

Investors may accordingly view/download the portfolio statement of schemes from the website of the AMC.

Investors can also request for the physical/soft copy of portfolio statement of schemes through any of the following modes:

- Give a call at our Contact Centre at:
  - MTNL/BSNL: 1800 222 999
  - Others: 1800 200 6666
- Send an email to [enquiry@icicipruamc.com](mailto:enquiry@icicipruamc.com)
- Submit a letter at any of the AMC Offices or our CAMS Investor Service Centres, details of which are available on the AMC website viz. [www.icicipruamc.com](http://www.icicipruamc.com).

**For ICICI Prudential Asset Management Company Limited**  
Sd/-  
Authorised Signatory

Place : Mumbai  
Date : October 09, 2021  
No. 003/10/2021

**To know more, call 1800 222 999/1800 200 6666 or visit [www.icicipruamc.com](http://www.icicipruamc.com)**

As part of the Go Green Initiative, investors are encouraged to register/update their e-mail id and mobile number to support paper-less communications.

To increase awareness about Mutual Funds, we regularly conduct Investor Awareness Programs across the country. To know more about it, please visit <https://www.icicipruamc.com> or visit AMFI's website <https://www.amfiindia.com>

**Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.**

**HDFC**  
MUTUAL FUND  
BHAROSA APNO KA

**HDFC Asset Management Company Limited**  
A Joint Venture with Standard Life Investments  
CIN: L65991MH1999PLC123027

**Registered Office:** HDFC House, 2nd Floor, H.T. Parekh Marg, 165-166, Backbay Reclamation, Churchgate, Mumbai - 400 020. Phone: 022 66316333 • Toll Free Nos: 1800-3010-6767 / 1800-419-7676  
Fax: 022 22821144 • e-mail: [hello@hdfcfund.com](mailto:hello@hdfcfund.com) • Visit us at: [www.hdfcfund.com](http://www.hdfcfund.com)

**NOTICE**

**Half-Yearly Portfolio Statement of Schemes of HDFC Mutual Fund**

NOTICE is hereby given that the statement of a complete Portfolio of the Schemes of HDFC Mutual Fund ("the Fund") for the half-year ended September 30, 2021 has been hosted on the website viz. [www.hdfcfund.com](http://www.hdfcfund.com) and on the AMFI website viz. [www.amfiindia.com](http://www.amfiindia.com).

Unit holders can submit a request for a physical or electronic copy of the statement of scheme portfolio by any of the following modes:

- call on our toll free number(s):
  - Within India: 1800 3010 6767 / 1800 419 7676;
  - From abroad: 91 44 3346 2406; or
- email us at [hello@hdfcfund.com](mailto:hello@hdfcfund.com); or
- SMS 'HDFCFM' to 56767 and the call center of the Fund will get in touch to cater the requests.

**For HDFC Asset Management Company Limited**  
(Investment Manager to HDFC Mutual Fund)  
Sd/-  
Authorized Signatory

Place : Mumbai  
Date : October 9, 2021

**MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.**

**SBI**  
भारतीय स्टेट बैंक  
भारतीय स्टेट बैंक  
STATE BANK OF INDIA

**Authorised Officer's Details:**  
Name: Smt.S.Gayathri,  
Asst. General Manager,  
E-mail id: [gayathri.s@sbi.co.in](mailto:gayathri.s@sbi.co.in)

**Address of the Branch:** 1st Floor, D. No.3-4-1013/A,  
1st Floor, CAC,TSRTC Bus Station, Kacheguda,  
Hyderabad. Telephone: 040 - 23147100 to 23147107  
Fax No.: 040 -29807791, E-mail id: [sbi.18359@sbi.co.in](mailto:sbi.18359@sbi.co.in)

**"APPENDIX-IV-A"**

**SALE NOTICE FOR SALE OF MOVABLE/IMMOVABLE PROPERTIES**  
**[Proviso to rule 6(2) & 8(6) of Security Interest (Enforcement) Rules]**

**E-Auction Sale Notice for sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6(2) & 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.**

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described movable/immovable properties mortgaged/charged to State Bank of India, the Secured Creditor, the physical possession of which has been taken by the Authorised Officer of State Bank of India, the Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis on 27.10.2021 for recovery of Rs.244,07,40,627.59 (Rupees Two hundred Forty Four crore Seven Lakh forty thousand Six Hundred Twenty seven and paise Fifty Nine only) as on 19.06.2014 plus interest at the contractual rate from 20.06.2014 minus recoveries if any and incidental charges and costs etc. due to the State Bank of India, Stressed Assets Management Branch-II, Kachiguda, Hyderabad, from the Borrower(s): 1) M/s. Good Health Agro Tech Pvt Ltd, 2) Shri Subash Chandra Agarwal, 3) Shri Kailash Chandra Agarwal, 4) Shri Vinod Kumar Agarwal, 5) Smt Lata Devi Agarwal, 6) Smt. Komal Devi Agarwal, 7) Smt. Kusum Devi Agarwal, 8) M/s. Nikhil Refineries Pvt Ltd, 9) Shri Subash Chandra Agarwal, 10) Shri Kailash Chandra Agarwal, 11) Shri Vinod Kumar Agarwal, 12) Smt. Akash Kumar Agarwal, 13) Shri Amit Kumar Agarwal, 14) Shri Sandeep Kumar Agarwal, 15) Smt. Komal Devi Agarwal, 16) Smt. Kusum Devi Agarwal and 17) Smt. Banwari Bai Agarwal W/o late Banwarilal Agarwal.

**SCHEDULE OF THE PROPERTIES**

**1. Lot No.1: (Plant & Machinery)**

(a) All Plant & Machinery of 300 TPD capacity Edible Oil Factory along with other movable assets hypothecated to Bank belonging to M/s Good Health Agro Tech Pvt Ltd erected/situated on the factory premises described below in property serial Nos. Lot-II A & B below.

(b) All Plant & Machinery of 200 TPD capacity Edible oil factory along with other movable assets hypothecated to Bank belonging to M/s Nikhil Refineries Pvt Ltd erected/situated on the factory premises described below in property serial No Lot-II-E below

**Lot No.2: (Immovable Property comprising Factory land & Building there on)**

(a) Factory land extent Ac.0.76 Cents Sy.Nos. 268/20 part, 268/22 part, 268/23 part, 268/25 part and 268/26 part situated at Thammavaram village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P belonging to M/s M/s Good Health Agro Tech Pvt Ltd.

(b) Land admeasuring Ac.0.40.6 Cents in Sy.No.268/23part, 268/26 part, 268/6 part situated at Thammavaram village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P. belonging to M/s Good Health Agro Tech Pvt Ltd.

(c) Factory land in Sy.No.268/13, 274/3 and 268/17 admeasuring Ac.1.50 Cents situated at Thammavaram Village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P belonging to M/s Good Health Agro Tech Pvt Ltd.

(d) All that Land on Sy.Nos.268/18,268/19,268/20,268/21,268/20 Part, admeasuring Ac.1.24 cents, situated at ADB Road, near to Vakalpuudi Light House, Thammavaram Village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P registered in the name of M/s Nikhil Refineries Pvt Ltd.

(e) All that Land & building constructed on Sy.Nos: 281/1, 281/2, 281/3, 281/4, 281/5part, 268/14P, 268/15P, 268/16P, 268/17P, 274/3 Part, admeasuring Ac.5.00 cents, situated at ADB Road, near to Vakalpuudi Light House, Thammavaram Village, Suryaraopeta Panchayat, East Godavari Dist. A.P. belonging to M/s Nikhil Refineries Pvt Ltd.

| S.No. | Property to be auctioned         | Date & Time of auction               | Reserve Price Below which the property will not be sold (In Rs.) | Earnest Money Deposit (In Rs.) | Date of receipt of EMD  |
|-------|----------------------------------|--------------------------------------|--|--------------------------------|-------------------------|
| 1     | Lot No. 1(a & b)                 | 10.30 AM to 11.30 AM on 27.10.2021   | 9,62,00,000/-  | 96,20,000/-                    | 26.10.2021 Upto 5.00 pm |
| 2     | Lot No. 2 (a,b,c,d & e) together | 11.00 AM to 12.00 Noon on 27.10.2021 | 20,56,00,000/-   | 2,05,60,000/-                  | 26.10.2021 Upto 5.00 pm |

**EMD Remittance:** The intending bidders have to get themselves registered on the INDIAN BANKS AUCTION PROPERTIES INFORMATION (IBAPI) PORTAL (<https://www.msccommerce.com/aucautionhome/ibapi/index.jsp>) for participation in the e-auction process. The Bidders have to register themselves well before the auction date as registration of bidders takes minimum of three working days. The intending bidder should submit the EMD deposit to IBAPI wallet in IBAPI portal through their Bank account.

For inspection and any clarifications, the intending bidders may contact the Manager Shri V. Srinivas Sharma on Mobile No.9346203999 or Bank's Approved Resolution Agent M/S Goodwill Associates, on Cell Nos.9949901281 or 9848327119.

**Note:** This is also a notice to the Borrower/ Guarantors of the said loan about holding of e-auction sale of the property on the aforesaid mentioned date if the dues are not repaid in full before the date of e-auction. For detailed terms and conditions of the sale, please refer to the link provided in State Bank of India, the Secured Creditor's website (a) "<http://www.sbi.co.in>" (b) <https://ibapi.in>

**Bidders may submit a single bid for all the properties mentioned in lots 1 & 2 above OR submit their bids for Plant & Machinery mentioned in Lot No.1(a&b) only.**

**However, Bids for Lot No.1 (a&b) will be considered only if there are no bids for lots 1 & 2 together.**

Intending Bidders are hereby informed that the borrowers have filed SA Nos 128 of 2020 & SA No 129 of 2020 at DRT Hyderabad. This auction sale shall be subject to outcome of the mentioned Sas.

**GST & taxes (if any) has to be borne by successful bidders over & above the bid amount.**

Date:06.10.2021 Place: Hyderabad Sd/- Authorized Officer, State Bank of India, SAMB-II, Hyderabad.

**MAHALAXMI RUBTECH LIMITED**  
(Corporate Identification Number: L25190GJ1991PLC16327)  
Registered Office: 47, New Cloth Market, Ahmedabad - 380002, Gujarat, India;

**Corporate Office:** Mahalaxmi House, Ysl Avenue, Opp. Ketav Petrol Pump, Polytechnic Road, Ambawadi, Ahmedabad - 380 015, Gujarat, India;  
Tel. No.: +91 79 40008000; Fax: +91 79 40008030;  
Email: [cs@mahalaxmigroup.net](mailto:cs@mahalaxmigroup.net); Website: [www.mrtglobal.com](http://www.mrtglobal.com);  
Contact Person: Mr. Kevin Dhruve, Company Secretary and Compliance Officer.

This Advertisement is being issued by Saffron Capital Advisors Private Limited, on behalf of Mahalaxmi Rubtech Limited, pursuant to the Securities and Exchange Board of India (Buy Back of Securities) Regulations, 2018 (The "Buyback Regulations") for the time being in force including any statutory modifications and amendments from time to time in respect of the buyback offer of the Mahalaxmi Rubtech Limited ("Offer").

**Kind Attention- Physical Shareholders**

Eligible Shareholders holding Equity Shares in physical form and who have not received the physical copy of LoF for any reason whatsoever, may send request to Registrar & Transfer Agent to the Offer, Cameo Corporate Services Limited at [priya@cameoindia.com](mailto:priya@cameoindia.com) and avail soft copy of the LoF. Alternatively, Eligible Shareholders may also download the soft copy of LoF from the website of SEBI's website, [www.sebi.gov.in](http://www.sebi.gov.in) or Manager to the Offer, [www.saffronadvisor.com](http://www.saffronadvisor.com) or Company, [www.mrtglobal.com](http://www.mrtglobal.com). Eligible Shareholders are required to refer to the Section titled "Process and methodology to be adopted for the buy-back" at page 39 of the LoF in relation to inter alia the procedure for tendering their Equity Shares in the buyback Offer and are required to adhere to and follow the procedure outlined therein. Capitalised terms used but not defined in this Advertisement shall have the same meanings assigned to such terms in the Public Announcement/DLOF/LOF. The Board of Directors of the Company accept full responsibility for the information contained in this Advertisement and also for the obligations of the Company as laid down in Securities and Exchange Board of India (Buy Back of Securities) Regulations, 2018 (The "Buyback Regulations").

**Issued by the Manager to the Offer on behalf of the Company**

**SAFFRON**  
emerging ideas

Saffron Capital Advisors Private Limited  
(Corporate Identification Number: U67120MH2007PTC166711)  
605, Sixth Floor, Centre Point, Andheri-Kurla Road, J. B. Nagar, Andheri (East), Mumbai - 400 059  
Tel. No.: +91 22 4082 0914/915 Fax No.: +91 22 4082 0999  
Email id: [buybacks@saffronadvisor.com](mailto:buybacks@saffronadvisor.com) Website: [www.saffronadvisor.com](http://www.saffronadvisor.com)  
Investor grievance: [investorgrievance@saffronadvisor.com](mailto:investorgrievance@saffronadvisor.com)  
SEBI Registration Number: INM00011211  
Contact Person: Amit Wagle / Gaurav Khandelwal  
Place: Ahmedabad  
Date: October 09, 2021

indianexpress.com

I arrive at a conclusion  
not an assumption.

Inform your opinion with  
detailed analysis.

The Indian Express.  
For the Indian Intelligent.

**The Indian EXPRESS**  
— JOURNALISM OF COURAGE —

**L&T Financial Services**  
Mutual Fund

**L&T Mutual Fund**  
6<sup>th</sup> Floor, Brindavan, Plot No. 177  
C. S. T. Road, Kalina  
Santacruz (East), Mumbai 400 098

call 1800 2000 400  
email [investor.line@lntmf.co.in](mailto:investor.line@lntmf.co.in)  
www.ltfs.com

**NOTICE (No. 43 of F.Y. 2021 – 2022)**

Notice is hereby given that in accordance with Regulation 59A of Securities and Exchange Board of India (Mutual Funds) Regulations, 1996 read with SEBI circular no. SEBI/HO/IMD/DF2/CIR/P/2018/92 dated June 05, 2018, the half-yearly statement of scheme portfolio of L&T Mutual Fund ("the Fund") for the half-year ended September 30, 2021 has been hosted on the website of the Fund viz. [www.ltfs.com](http://www.ltfs.com) and on the website of AMFI viz. [www.amfiindia.com](http://www.amfiindia.com).

Investors can request for physical/soft copy of statement of scheme portfolio through any of the following means:

- SMS:- Send SMS to 567678 from investor's registered mobile number. SMS format "LTMFHE <Space>Folio no. for soft copy and LTMFHP <Space>Folio no. for physical copy.
- Telephone:- Give a call at our toll-free no. at 1800 2000 400 & 1800 4190 200
- E-mail:- Send an email to [investor.line@lntmf.co.in](mailto:investor.line@lntmf.co.in)
- Letter:- Submit a letter at any of the AMC Offices or CAMS investor Service Centres, details available at [www.ltfs.com](http://www.ltfs.com).

Investors/ Unit holders are requested to take note of the aforesaid.

**For L&T Investment Management Limited**  
CIN: U65991MH1996PLC229572  
(Investment Manager to L&T Mutual Fund)

Sd/-  
Authorised Signatory

Date : October 09, 2021  
Place : Mumbai

**Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.**

CL08734

Ahmedabad



# ટીવીએસ મોટરે ૧૨૫ સીસીવાળું સ્કૂટર જ્યુપિટર ૧૨૫ લોન્ચ કર્યું

**પીટીઆઇ**  
નવી દિલ્હી, તા. ૧૦  
ટુ અને થ્રી વ્હીલર નિર્માતા ટીવીએસ મોટરે દેશમાં તેના ઉત્પાદનોનો પોર્ટફોલિયો વિસ્તારતાં ૩૫.૭૩,૪૦૦ (એક્સ-શોરૂમ) નવી દિલ્હીના ભાવમાં તેની છેલ્લી રજૂઆત ૧૨૫ સીસીના સ્કૂટર ટીવીએસ જ્યુપિટરને રજૂ કર્યું છે. નવા ૧૨૫ સીસીના એન્જિન, ઉદ્યોગમાં શ્રેષ્ઠ માઇલેજ, ગતિમાં શ્રેષ્ઠ સહિતના ના ફીચર સાથે સજ્જ છે, સ્કૂટર સૌથી મોટી સીટ હેઠળ

સંગ્રહ, સૌથી લાંબી સીટ પણ ધરાવે છે. તેમ એક યાદીમાં કંપનીએ જણાવ્યું હતું. ટીવીએસ મોટર કંપનીમાં અમે ૨૦૧૩માં તેની શરૂઆતથી અત્યાર સુધી ચાર માર્કેટ પર અમે હંમેશા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ટીવીએસ જ્યુપિટર દેશમાં સૌથી વધુ પ્રસંશા ધરાવતા સ્કૂટરમાંથી એક છે, તેમ કંપનીના ડિરેક્ટર અને ગતિમાં શ્રેષ્ઠ સહિતના ના ફીચર સાથે સજ્જ છે, સ્કૂટર સૌથી મોટી સીટ હેઠળ

# સ્કોડાએ ભારતીય બજાર માટે તેની નવી સેડાનનું નામ સ્લેવિયા રાખ્યું

**પીટીઆઇ**  
નવી દિલ્હી, તા. ૧૦  
એક કાર ઉત્પાદક કંપની સ્કોડાએ ભારતીય બજાર માટેની તેની આગામી સેડાનનું નામ સ્લેવિયા રાખ્યું છે. સ્કોડાના વડપણ હેઠળના ઇન્ડિયા ૨.૦ પ્રોજેક્ટના કુશાક પછીનું બીજું પ્રોજેક્ટનું મોડેલને સ્લેવિયા તરીકે ઓળખવામાં આવશે, તેમ કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું. આ નવી સેડાન આ વર્ષના ઉત્તરાર્ધમાં રજૂ કરવામાં આવશે અને તે ભારતમાં એકોટિવિયા અને સુપર્બ સેડાનની પૂરક બની રહેશે. નવી પ્રિમીયમ મિડ-સાઇઝ સેડાનનું નામ સ્કોડા ઓટોના પ્રારંભિક દિવસોને ધ્યાનમાં

રાખીને રાખવામાં આવ્યું છે. કંપનીની સ્થાપના થયાના એક વર્ષ બાદ, ૧૮૯૬માં વાક્લેવ લરિન અને વાક્લેવ ક્લેમેન્ટે સ્લેવિયા નામ હેઠળ તેમની પ્રથમ, સંયુક્તપણે વિકસાવેલી સાઇકલોનું વિકાસ કર્યું હતું. આગામી સ્કોડા સ્લેવિયા ફરી એક વખત ભારતીય બજારમાં નવા યુગને સ્પર્ધાકૃત કરશે, તેમ કંપનીએ જણાવ્યું હતું. સ્કોડા ૧૨૫થી વધુ વર્ષનો સમૃદ્ધ વૈશ્વિક વારસો ધરાવે છે. સ્લેવિયા નામ સફળ ગાથાની શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે, જેણે સ્કોડાને ઉત્પાદક કંપનીને અગ્રણી કાર ઉત્પાદક બનાવતાં જોડે છે. સમૃદ્ધ પરંપરા ધરાવતું સ્લેવિયા નામ ફરી એક વખત ભારતીય

**BIECCO LAWRIE LTD.**  
CIN: U51909WB1919PLC003559  
Regd. Office: 6 Mayurbhary Road  
Kolkata-700023

NOTICE is hereby given that the 101st Annual General Meeting of the Members of Biecco Lawrie Limited will be held on 09.11.2021 at 11.30 A.M. through WEBEX platform. Login credentials containing user id and password for the meeting will be e-mailed to the registered e-mail address. Members of the Company are requested to register their e-mail addresses enabling them to receive the Notice of 101st Annual General Meeting of the Company in electronic form as per Ministry of Corporate Affairs' Circulars by sending email at [bieccolawrie1919@gmail.com](mailto:bieccolawrie1919@gmail.com) along with Name of Shareholder(s), Copy of Share Certificates and Self attested Address proof before 02.11.2021. No physical copy of Notice shall be sent to Members.

For Biecco Lawrie Limited  
Sd/-  
R.S.  
Managing Director

# ટોયોટાએ લેજેન્ડર એસયુવીના ઓલ વ્હીલ ડ્રાઇવ વર્જનની રજૂઆત કરી

**પીટીઆઇ**  
નવી દિલ્હી, તા. ૧૦  
ટોયોટા કિર્લોસ્કર મોટરે (ટીકેએમ) રૂપિયા ૪૨.૩૩ લાખ (એક્સ-શોરૂમ)ના ભાવમાં તેની પ્રિમિયમ એસયુવી લેજેન્ડરની ઓલ વ્હીલ ડ્રાઇવ (ફોરબાયફોર) રજૂ કરી છે. ફોરએક્સફોર લેજેન્ડર ટિક્સ ઓટોમેટિક ટ્રાન્સમિશન (એટી) સાથે, ૨૦૪ પીસી વીજ ઉત્પાદન સાથે ૨.૮ લિટર ડીઝલ એન્જિન દ્વારા પાવર છે, તેમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. આ રજૂઆત અંગે ટિપ્પણી કરતાં ટીકેએમના એસોસિએટ જનરલ

# ઓટો રિટેલ્સને ચિપની અછતથી તહેવારોમાં મોટો ફટકો પડી શકે

**પીટીઆઇ**  
નવી દિલ્હી, તા. ૧૦  
એફએડીએના ટોચના અધિકારીઓના અનુસાર, વર્તમાન સેમીકન્ડક્ટરની અછતની વચ્ચે ઉત્પાદકો ડિલરશીપને વાહનો મોકલવા માટે સંઘર્ષનો સામનો કરતા ચાલુ તહેવારોની સીઝનમાં ઓટોમોબાઇલના રિટેલર્સ જંગી નુકસાનનો સામનો કરી રહ્યા છે. ચીપની અછત અવિરતપણે ચાલુ હોવાથી ઓટો ઉત્પાદકોને ઉત્પાદનના પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે ડીલર ભાગીદારોને પુરવઠો ઘટાડવાની ફરજ પાડે છે. જરૂરિયાત લાંબા તહેવારની સીઝનની શરૂઆત નવરાત્રી થાય છે, ડીલરોને ગ્રાહકોને

અને નુકસાન પર નજર રાખી રહ્યા છે. તેમ એફએડીએના અછત વેંકટેશ ગુલાટીએ પીટીઆઇને જણાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, ઉત્તર ભારતના સેગમેન્ટના મોટાભાગના મોડેલમાં ૧થી ૩ મહિનાનો વેઈટિંગ પિરિયડ ચાલી રહ્યો છે.

**Rajasthan State Mines & Minerals Limited**  
(A Government of Rajasthan Enterprise)  
4, Meera Marg, Udaipur - 313001  
Phone: (0294)2427177 / 2428763&67, Fax (0294)2428768, 2428739  
Email: [contracts@rsmmilrajasthan.gov.in](mailto:contracts@rsmmilrajasthan.gov.in)

**Notice Inviting e-Tender** Date: 08.10.2021

| Sl. No. & Date  | Description of Work  |
|---|--|
| e-Tender no. Cont-11/2021-22 dated 07.10.2021<br>UJBN No. MM12122W0800011 | Operation and Maintenance of Departmental HGO Crushing Plant (Rated Capacity 130 TPH), for the production of (-) 12 mm Rock Phosphate Chips, with Manpower, All type of Spares/Consumables Including Feeding of Ore into Hopper by Combination of Loaders & Dumpers and other Miscellaneous work at Jhamarkotra Rock Phosphate Mine, Udaipur (Rajasthan). Contract value Rs. 1538.00 Lakh, EMD 30.76 Lac., Tender Fees Rs. 4720/-                                  |
| e-Tender no. Cont-12/2021-22 dated 07.10.2021<br>UJBN No. MM12122W0800011 | Loading of different types of ore from different ore Stacks located around LGO Crushing Plant (by using front loaders) into the truck/trippers; transportation of loaded truck/trippers to an average lead (to & fro) of approximately 0.50 km and unloading into the hopper of LGO Crushing Plant including all preparatory & allied work pertaining there to and/or relating to this work. Contract value Rs. 150.00 Lakh, EMD 3.00 Lac., Tender Fees Rs. 4720/- |

Other terms & conditions have been given in detailed tender for which please visit us at our website [www.rsmm.com](http://www.rsmm.com) or [www.sppp.rajasthan.gov.in](http://www.sppp.rajasthan.gov.in) or [eproc.rajasthan.gov.in](http://eproc.rajasthan.gov.in) or contact GGM(Contract) on above address.  
Raj.samwad/C/21/7114 DGM (Admin)

**MAHALAXMI RUBTECH LIMITED**  
(Corporate Identification Number: L25190GJ1991PLC016327)  
Registered Office: 47, New Cloth Market, Ahmedabad - 380022, Gujarat, India;

Corporate Office: Mahalaxmi House, Ysl Avenue, Opp. Ketav Petrol Pump, Polytechnic Road, Ambavadi, Ahmedabad - 380 015, Gujarat, India;  
Tel. No.: +91 79 40008000; Fax: +91 79 40008030;  
Email: [cs@mahalaxmigrp.net](mailto:cs@mahalaxmigrp.net); Website: [www.mrtglobal.com](http://www.mrtglobal.com)  
Contact Person: Mr. Kevin Dhruve, Company Secretary and Compliance Officer.

This Advertisement is being issued by Saffron Capital Advisors Private Limited, on behalf of Mahalaxmi Rubtech Limited, pursuant to the Securities and Exchange Board of India (Buy Back of Securities) Regulations, 2018 (The "Buyback Regulations") for the time being in force including any statutory modifications and amendments from time to time in respect of the buyback offer of the Mahalaxmi Rubtech Limited ("Offer").

**Kind Attention - Physical Shareholders**  
Eligible Shareholders holding Equity Shares in physical form and who have not received the physical copy of LoF for any reason whatsoever, may send request to Registrar & Transfer Agent to the Offer, Corporate Corporate Services Limited at [priva@cameoindia.com](mailto:priva@cameoindia.com) and avail soft copy of the LoF. Alternatively, Eligible Shareholders may also download the soft copy of LoF from the website of SEBI's website, [www.sebi.gov.in](http://www.sebi.gov.in) or Manager to the Offer, [www.saffronadvisor.com](http://www.saffronadvisor.com) or Company, [www.mrtglobal.com](http://www.mrtglobal.com). Eligible Shareholders are required to refer to the Section titled "Process and methodology to be adopted for the buy-back" at page 39 of the LoF in relation to inter alia the procedure for tendering their Equity Shares in the buyback Offer and are required to adhere to and follow the procedure outlined therein. Capitalised terms used but not defined in this Advertisement shall have the same meanings assigned to such terms in the Public Announcement/DLOF/LOF. The Board of Directors of the Company accept full responsibility for the information contained in this Advertisement and also for the obligations of the Company as laid down in Securities and Exchange Board of India (Buy Back of Securities) Regulations, 2018 (The "Buyback Regulations").

**Issued by the Manager to the Offer on behalf of the Company**

**SAFFRON**  
Saffron Capital Advisors Private Limited  
(Corporate Identification Number: U67120MH2007PTC166711)  
605, Sixth Floor, Centre Point, Andheri-Kurla Road, J. B. Nagar, Andheri (East), Mumbai - 400 059  
Tel. No.: +91 22 4082 0914/915 Fax No.: +91 22 4082 0999  
Email id: [buybacks@saffronadvisor.com](mailto:buybacks@saffronadvisor.com) Website: [www.saffronadvisor.com](http://www.saffronadvisor.com)  
Investor grievance: [investorgrievance@saffronadvisor.com](mailto:investorgrievance@saffronadvisor.com)  
SEBI Registration Number: INM000011211  
Contact Person: Amit Wagie / Gaurav Khandelwal  
Place: Ahmedabad  
Date: October 09, 2021

**ઈ-હરાજી સહ વેચાણની જાહેર નોટીસ (પરિશિષ્ટ-૪ એ) (નિયમ ૮ (ક))**

વિશ્વવિદ્યાલય અને ટીઆરઆઇ સહ વેચાણની જાહેર નોટીસ (પરિશિષ્ટ-૪ એ) (નિયમ ૮ (ક))

| સંખ્યા/સંજ્ઞા (સી/ જમીન/સહ વેચાણ)  | વેચાણની તારીખ અને સમય  | વિગત/ વિશિષ્ટ શરતો   | સ્થળ/ વિશિષ્ટ વિગત/ વિશિષ્ટ શરતો   | કિંમત હિમત | વિશિષ્ટ નોંધણીની તારીખ |
|--|--|--|--|------------|------------------------|
| ૧. શ્રી મહાલક્ષ્મી મલ્ટીપુર્પુષ્પી ૨. શ્રીમતી સીતાબાઈ મહાલક્ષ્મી ૩. શ્રી શ્યામલ દુધાઈ માણી ૪. શ્રી ડી. વી. ડી. ડી. (સીઆઈસી) નં. ૨૬૭૨૪૨૪૨ | ૧૪ ડિસેમ્બર, ૨૦૨૦<br>૧૫ ડિસેમ્બર, ૨૦૨૦<br>૧૬ ડિસેમ્બર, ૨૦૨૦<br>૧૭ ડિસેમ્બર, ૨૦૨૦ | ૧૫ ડિસેમ્બર, ૨૦૨૦<br>૧૬ ડિસેમ્બર, ૨૦૨૦<br>૧૭ ડિસેમ્બર, ૨૦૨૦<br>૧૮ ડિસેમ્બર, ૨૦૨૦ | ૧૫૦૦ નં. ૩૫, ૧૫૦૦ નં. ૧૫૮, ૧૫૦૦ નં. ૧૫૯, ૧૫૦૦ નં. ૧૬૦, ૧૫૦૦ નં. ૧૬૧, ૧૫૦૦ નં. ૧૬૨, ૧૫૦૦ નં. ૧૬૩, ૧૫૦૦ નં. ૧૬૪, ૧૫૦૦ નં. ૧૬૫, ૧૫૦૦ નં. ૧૬૬, ૧૫૦૦ નં. ૧૬૭, ૧૫૦૦ નં. ૧૬૮, ૧૫૦૦ નં. ૧૬૯, ૧૫૦૦ નં. ૧૭૦, ૧૫૦૦ નં. ૧૭૧, ૧૫૦૦ નં. ૧૭૨, ૧૫૦૦ નં. ૧૭૩, ૧૫૦૦ નં. ૧૭૪, ૧૫૦૦ નં. ૧૭૫, ૧૫૦૦ નં. ૧૭૬, ૧૫૦૦ નં. ૧૭૭, ૧૫૦૦ નં. ૧૭૮, ૧૫૦૦ નં. ૧૭૯, ૧૫૦૦ નં. ૧૮૦, ૧૫૦૦ નં. ૧૮૧, ૧૫૦૦ નં. ૧૮૨, ૧૫૦૦ નં. ૧૮૩, ૧૫૦૦ નં. ૧૮૪, ૧૫૦૦ નં. ૧૮૫, ૧૫૦૦ નં. ૧૮૬, ૧૫૦૦ નં. ૧૮૭, ૧૫૦૦ નં. ૧૮૮, ૧૫૦૦ નં. ૧૮૯, ૧૫૦૦ નં. ૧૯૦, ૧૫૦૦ નં. ૧૯૧, ૧૫૦૦ નં. ૧૯૨, ૧૫૦૦ નં. ૧૯૩, ૧૫૦૦ નં. ૧૯૪, ૧૫૦૦ નં. ૧૯૫, ૧૫૦૦ નં. ૧૯૬, ૧૫૦૦ નં. ૧૯૭, ૧૫૦૦ નં. ૧૯૮, ૧૫૦૦ નં. ૧૯૯, ૧૫૦૦ નં. ૨૦૦, ૧૫૦૦ નં. ૨૦૧, ૧૫૦૦ નં. ૨૦૨, ૧૫૦૦ નં. ૨૦૩, ૧૫૦૦ નં. ૨૦૪, ૧૫૦૦ નં. ૨૦૫, ૧૫૦૦ નં. ૨૦૬, ૧૫૦૦ નં. ૨૦૭, ૧૫૦૦ નં. ૨૦૮, ૧૫૦૦ નં. ૨૦૯, ૧૫૦૦ નં. ૨૧૦, ૧૫૦૦ નં. ૨૧૧, ૧૫૦૦ નં. ૨૧૨, ૧૫૦૦ નં. ૨૧૩, ૧૫૦૦ નં. ૨૧૪, ૧૫૦૦ નં. ૨૧૫, ૧૫૦૦ નં. ૨૧૬, ૧૫૦૦ નં. ૨૧૭, ૧૫૦૦ નં. ૨૧૮, ૧૫૦૦ નં. ૨૧૯, ૧૫૦૦ નં. ૨૨૦, ૧૫૦૦ નં. ૨૨૧, ૧૫૦૦ નં. ૨૨૨, ૧૫૦૦ નં. ૨૨૩, ૧૫૦૦ નં. ૨૨૪, ૧૫૦૦ નં. ૨૨૫, ૧૫૦૦ નં. ૨૨૬, ૧૫૦૦ નં. ૨૨૭, ૧૫૦૦ નં. ૨૨૮, ૧૫૦૦ નં. ૨૨૯, ૧૫૦૦ નં. ૨૩૦, ૧૫૦૦ નં. ૨૩૧, ૧૫૦૦ નં. ૨૩૨, ૧૫૦૦ નં. ૨૩૩, ૧૫૦૦ નં. ૨૩૪, ૧૫૦૦ નં. ૨૩૫, ૧૫૦૦ નં. ૨૩૬, ૧૫૦૦ નં. ૨૩૭, ૧૫૦૦ નં. ૨૩૮, ૧૫૦૦ નં. ૨૩૯, ૧૫૦૦ નં. ૨૪૦, ૧૫૦૦ નં. ૨૪૧, ૧૫૦૦ નં. ૨૪૨, ૧૫૦૦ નં. ૨૪૩, ૧૫૦૦ નં. ૨૪૪, ૧૫૦૦ નં. ૨૪૫, ૧૫૦૦ નં. ૨૪૬, ૧૫૦૦ નં. ૨૪૭, ૧૫૦૦ નં. ૨૪૮, ૧૫૦૦ નં. ૨૪૯, ૧૫૦૦ નં. ૨૫૦, ૧૫૦૦ નં. ૨૫૧, ૧૫૦૦ નં. ૨૫૨, ૧૫૦૦ નં. ૨૫૩, ૧૫૦૦ નં. ૨૫૪, ૧૫૦૦ નં. ૨૫૫, ૧૫૦૦ નં. ૨૫૬, ૧૫૦૦ નં. ૨૫૭, ૧૫૦૦ નં. ૨૫૮, ૧૫૦૦ નં. ૨૫૯, ૧૫૦૦ નં. ૨૬૦, ૧૫૦૦ નં. ૨૬૧, ૧૫૦૦ નં. ૨૬૨, ૧૫૦૦ નં. ૨૬૩, ૧૫૦૦ નં. ૨૬૪, ૧૫૦૦ નં. ૨૬૫, ૧૫૦૦ નં. ૨૬૬, ૧૫૦૦ નં. ૨૬૭, ૧૫૦૦ નં. ૨૬૮, ૧૫૦૦ નં. ૨૬૯, ૧૫૦૦ નં. ૨૭૦, ૧૫૦૦ નં. ૨૭૧, ૧૫૦૦ નં. ૨૭૨, ૧૫૦૦ નં. ૨૭૩, ૧૫૦૦ નં. ૨૭૪, ૧૫૦૦ નં. ૨૭૫, ૧૫૦૦ નં. ૨૭૬, ૧૫૦૦ નં. ૨૭૭, ૧૫૦૦ નં. ૨૭૮, ૧૫૦૦ નં. ૨૭૯, ૧૫૦૦ નં. ૨૮૦, ૧૫૦૦ નં. ૨૮૧, ૧૫૦૦ નં. ૨૮૨, ૧૫૦૦ નં. ૨૮૩, ૧૫૦૦ નં. ૨૮૪, ૧૫૦૦ નં. ૨૮૫, ૧૫૦૦ નં. ૨૮૬, ૧૫૦૦ નં. ૨૮૭, ૧૫૦૦ નં. ૨૮૮, ૧૫૦૦ નં. ૨૮૯, ૧૫૦૦ નં. ૨૯૦, ૧૫૦૦ નં. ૨૯૧, ૧૫૦૦ નં. ૨૯૨, ૧૫૦૦ નં. ૨૯૩, ૧૫૦૦ નં. ૨૯૪, ૧૫૦૦ નં. ૨૯૫, ૧૫૦૦ નં. ૨૯૬, ૧૫૦૦ નં. ૨૯૭, ૧૫૦૦ નં. ૨૯૮, ૧૫૦૦ નં. ૨૯૯, ૧૫૦૦ નં. ૩૦૦, ૧૫૦૦ નં. ૩૦૧, ૧૫૦૦ નં. ૩૦૨, ૧૫૦૦ નં. ૩૦૩, ૧૫૦૦ નં. ૩૦૪, ૧૫૦૦ નં. ૩૦૫, ૧૫૦૦ નં. ૩૦૬, ૧૫૦૦ નં. ૩૦૭, ૧૫૦૦ નં. ૩૦૮, ૧૫૦૦ નં. ૩૦૯, ૧૫૦૦ નં. ૩૧૦, ૧૫૦૦ નં. ૩૧૧, ૧૫૦૦ નં. ૩૧૨, ૧૫૦૦ નં. ૩૧૩, ૧૫૦૦ નં. ૩૧૪, ૧૫૦૦ નં. ૩૧૫, ૧૫૦૦ નં. ૩૧૬, ૧૫૦૦ નં. ૩૧૭, ૧૫૦૦ નં. ૩૧૮, ૧૫૦૦ નં. ૩૧૯, ૧૫૦૦ નં. ૩૨૦, ૧૫૦૦ નં. ૩૨૧, ૧૫૦૦ નં. ૩૨૨, ૧૫૦૦ નં. ૩૨૩, ૧૫૦૦ નં. ૩૨૪, ૧૫૦૦ નં. ૩૨૫, ૧૫૦૦ નં. ૩૨૬, ૧૫૦૦ નં. ૩૨૭, ૧૫૦૦ નં. ૩૨૮, ૧૫૦૦ નં. ૩૨૯, ૧૫૦૦ નં. ૩૩૦, ૧૫૦૦ નં. ૩૩૧, ૧૫૦૦ નં. ૩૩૨, ૧૫૦૦ નં. ૩૩૩, ૧૫૦૦ નં. ૩૩૪, ૧૫૦૦ નં. ૩૩૫, ૧૫૦૦ નં. ૩૩૬, ૧૫૦૦ નં. ૩૩૭, ૧૫૦૦ નં. ૩૩૮, ૧૫૦૦ નં. ૩૩૯, ૧૫૦૦ નં. ૩૪૦, ૧૫૦૦ નં. ૩૪૧, ૧૫૦૦ નં. ૩૪૨, ૧૫૦૦ નં. ૩૪૩, ૧૫૦૦ નં. ૩૪૪, ૧૫૦૦ નં. ૩૪૫, ૧૫૦૦ નં. ૩૪૬, ૧૫૦૦ નં. ૩૪૭, ૧૫૦૦ નં. ૩૪૮, ૧૫૦૦ નં. ૩૪૯, ૧૫૦૦ નં. ૩૫૦, ૧૫૦૦ નં. ૩૫૧, ૧૫૦૦ નં. ૩૫૨, ૧૫૦૦ નં. ૩૫૩, ૧૫૦૦ નં. ૩૫૪, ૧૫૦૦ નં. ૩૫૫, ૧૫૦૦ નં. ૩૫૬, ૧૫૦૦ નં. ૩૫૭, ૧૫૦૦ નં. ૩૫૮, ૧૫૦૦ નં. ૩૫૯, ૧૫૦૦ નં. ૩૬૦, ૧૫૦૦ નં. ૩૬૧, ૧૫૦૦ નં. ૩૬૨, ૧૫૦૦ નં. ૩૬૩, ૧૫૦૦ નં. ૩૬૪, ૧૫૦૦ નં. ૩૬૫, ૧૫૦૦ નં. ૩૬૬, ૧૫૦૦ નં. ૩૬૭, ૧૫૦૦ નં. ૩૬૮, ૧૫૦૦ નં. ૩૬૯, ૧૫૦૦ નં. ૩૭૦, ૧૫૦૦ નં. ૩૭૧, ૧૫૦૦ નં. ૩૭૨, ૧૫૦૦ નં. ૩૭૩, ૧૫૦૦ નં. ૩૭૪, ૧૫૦૦ નં. ૩૭૫, ૧૫૦૦ નં. ૩૭૬, ૧૫૦૦ નં. ૩૭૭, ૧૫૦૦ નં. ૩૭૮, ૧૫૦૦ નં. ૩૭૯, ૧૫૦૦ નં. ૩૮૦, ૧૫૦૦ નં. ૩૮૧, ૧૫૦૦ નં. ૩૮૨, ૧૫૦૦ નં. ૩૮૩, ૧૫૦૦ નં. ૩૮૪, ૧૫૦૦ નં. ૩૮૫, ૧૫૦૦ નં. ૩૮૬, ૧૫૦૦ નં. ૩૮૭, ૧૫૦૦ નં. ૩૮૮, ૧૫૦૦ નં. ૩૮૯, ૧૫૦૦ નં. ૩૯૦, ૧૫૦૦ નં. ૩૯૧, ૧૫૦૦ નં. ૩૯૨, ૧૫૦૦ નં. ૩૯૩, ૧૫૦૦ નં. ૩૯૪, ૧૫૦૦ નં. ૩૯૫, ૧૫૦૦ નં. ૩૯૬, ૧૫૦૦ નં. ૩૯૭, ૧૫૦૦ નં. ૩૯૮, ૧૫૦૦ નં. ૩૯૯, ૧૫૦૦ નં. ૪૦૦, ૧૫૦૦ નં. ૪૦૧, ૧૫૦૦ નં. ૪૦૨, ૧૫૦૦ નં. ૪૦૩, ૧૫૦૦ નં. ૪૦૪, ૧૫૦૦ નં. ૪૦૫, ૧૫૦૦ નં. ૪૦૬, ૧૫૦૦ નં. ૪૦૭, ૧૫૦૦ નં. ૪૦૮, ૧૫૦૦ નં. ૪૦૯, ૧૫૦૦ નં. ૪૧૦, ૧૫૦૦ નં. ૪૧૧, ૧૫૦૦ નં. ૪૧૨, ૧૫૦૦ નં. ૪૧૩, ૧૫૦૦ નં. ૪૧૪, ૧૫૦૦ નં. ૪૧૫, ૧૫૦૦ નં. ૪૧૬, ૧૫૦૦ નં. ૪૧૭, ૧૫૦૦ નં. ૪૧૮, ૧૫૦૦ નં. ૪૧૯, ૧૫૦૦ નં. ૪૨૦, ૧૫૦૦ નં. ૪૨૧, ૧૫૦૦ નં. ૪૨૨, ૧૫૦૦ નં. ૪૨૩, ૧૫૦૦ નં. ૪૨૪, ૧૫૦૦ નં. ૪૨૫, ૧૫૦૦ નં. ૪૨૬, ૧૫૦૦ નં. ૪૨૭, ૧૫૦૦ નં. ૪૨૮, ૧૫૦૦ નં. ૪૨૯, ૧૫૦૦ નં. ૪૩૦, ૧૫૦૦ નં. ૪૩૧, ૧૫૦૦ નં. ૪૩૨, ૧૫૦૦ નં. ૪૩૩, ૧૫૦૦ નં. ૪૩૪, ૧૫૦૦ નં. ૪૩૫, ૧૫૦૦ નં. ૪૩૬, ૧૫૦૦ નં. ૪૩૭, ૧૫૦૦ નં. ૪૩૮, ૧૫૦૦ નં. ૪૩૯, ૧૫૦૦ નં. ૪૪૦, ૧૫૦૦ નં. ૪૪૧, ૧૫૦૦ નં. ૪૪૨, ૧૫૦૦ નં. ૪૪૩, ૧૫૦૦ નં. ૪૪૪, ૧૫૦૦ નં. ૪૪૫, ૧૫૦૦ નં. ૪૪૬, ૧૫૦૦ નં. ૪૪૭, ૧૫૦૦ નં. ૪૪૮, ૧૫૦૦ નં. ૪૪૯, ૧૫૦૦ નં. ૪૫૦, ૧૫૦૦ નં. ૪૫૧, ૧૫૦૦ નં. ૪૫૨, ૧૫૦૦ નં. ૪૫૩, ૧૫૦૦ નં. ૪૫૪, ૧૫૦૦ નં. ૪૫૫, ૧૫૦૦ નં. ૪૫૬, ૧૫૦૦ નં. ૪૫૭, ૧૫૦૦ નં. ૪૫૮, ૧૫૦૦ નં. ૪૫૯, ૧૫૦૦ નં. ૪૬૦, ૧૫૦૦ નં. ૪૬૧, ૧૫૦૦ નં. ૪૬૨, ૧૫૦૦ નં. ૪૬૩, ૧૫૦૦ નં. ૪૬૪, ૧૫૦૦ નં. ૪૬૫, ૧૫૦૦ નં. ૪૬૬, ૧૫૦૦ નં. ૪૬૭, ૧૫૦૦ નં. ૪૬૮, ૧૫૦૦ નં. ૪૬૯, ૧૫૦૦ નં. ૪૭૦, ૧૫૦૦ નં. ૪૭૧, ૧૫૦૦ નં. ૪૭૨, ૧૫૦૦ નં. ૪૭૩, ૧૫૦૦ નં. ૪૭૪, ૧૫૦૦ નં. ૪૭૫, ૧૫૦૦ નં. ૪૭૬, ૧૫૦૦ નં. ૪૭૭, ૧૫૦૦ નં. ૪૭૮, ૧૫૦૦ નં. ૪૭૯, ૧૫૦૦ નં. ૪૮૦, ૧૫૦૦ નં. ૪૮૧, ૧૫૦૦ નં. ૪૮૨, ૧૫૦૦ નં. ૪૮૩, ૧૫૦૦ નં. ૪૮૪, ૧૫૦૦ નં. ૪૮૫, ૧૫૦૦ નં. ૪૮૬, ૧૫૦૦ નં. ૪૮૭, ૧૫૦૦ નં. ૪૮૮, ૧૫૦૦ નં. ૪૮૯, ૧૫૦૦ નં. ૪૯૦, ૧૫૦૦ નં. ૪૯૧, ૧૫૦૦ નં. ૪૯૨, ૧૫૦૦ નં. ૪૯૩, ૧૫૦૦ નં. ૪૯૪, ૧૫૦૦ નં. ૪૯૫, ૧૫૦૦ નં. ૪૯૬, ૧૫૦૦ નં. ૪૯૭, ૧૫૦૦ નં. ૪૯૮, ૧૫૦૦ નં. ૪૯૯, ૧૫૦૦ નં. ૫૦૦, ૧૫૦૦ નં. ૫૦૧, ૧૫૦૦ નં. ૫૦ |            |                        |